

ખસેડવામાં આવેલ છે. સ્થળાંતરમાં ૨,૪૯૮ પુરૂષો, ૨,૪૨૦ સ્ત્રીઓ તથા ૨,૯૮૨ જેટલાં બાળકોનો સમાવેશ થાય છે. આવશ્યકતા અનુસાર સ્થળાંતરીત લોકો માટે શહેરમાં અંદાજિત ૭૫ આશ્રયસ્થાનો (શાળાઓ, આંગણવાડી, કોમ્યુનીટી હોલ તથા નાઈટ શેલ્ટર્સ વિગેરે)માં આશ્રીતો માટે જમવા, પાણી તથા સેનીટેશન વિગેરે તમામની પુરતી વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.

કમિશનરશ્રી વધુમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તથા અલગ અલગ સંસ્થાઓની મદદથી કુલ ૮૦,૦૦૦ જેટલા કુડ પેકેટ તૈયાર કરવામાં આવેલ છે. શહેરના વિવિધ ૧૯ સ્થળો પરથી ત્રીસ (૩૦) જેટલા ભયગ્રસ્ત વૃક્ષો ટ્રીમ કરવામાં આવેલ છે. અલબત્ત જ્યુબિલી કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડ કનાત્રોલ રૂમ પર શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝાડ નમી ગયાનું કે ભયગ્રસ્ત હોવાની ૮ ફરિયાદો મળતા જોખમની સંભાવના દુર કરવામાં આવેલ છે. જ્યારે ધરમ ટોકીઝ પાછળ એક ઝાડ પડતા એક કાર અને બે દ્વિ ચક્રી વાહનો દબાયાની ફરિયાદને પગલે ફાયર બ્રિગેડ શાખાએ ઝાડ કાપી વાહન બહાર કઢાવ્યા હતાં.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં ચાલતી આવાસ યોજનાઓની બાંધકામ સાઈટ પરથી અંદાજે ૧,૧૬૦ જેટલા શ્રમજીવીઓને નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે તથા તેઓ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે શહેરના વિવિધ જાહેર સ્થળો તથા રસ્તાઓ પર રહેતાં ૫૯૦ જેટલા બેઘર લોકોને નજીકના રેનબસેરા કે અન્ય સલામત સ્થળો પર સ્થળાંતર કરવામાં આવેલ છે.

કમિશનરશ્રીએ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળો પરથી ભયજનક જણાંતા ૧૦૨ જેટલા અલગ અલગ સાઈઝના ફ્લેક્સ તથા ૫૩ સ્ટ્રકચર સ્થળ પરથી ઉતારી લેવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત "રૂડા" (રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ)ના ચેરમેન શ્રી બંધાનિધિ પાનીનાં માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા ન્યારી નદીના કાંઠે આવેલ વિવિધ ગામડાઓમાંથી કુલ ૫૬૪ તથા આજી નદીનાં કાંઠાના વિસ્તારોમાંથી ૪૦૦ એમ કુલ મળીને ૯૬૪ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "આઈ-વે પ્રોજેક્ટ"ના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)ની મદદથી સમગ્ર શહેરની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં ક્યાંય પણ મહાનગરપાલિકાની મદદની આવશ્યકતા ઉભી થશે ત્યાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકો તુર્ત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે તે માટે મ્યુનિ. કમિશનરશ્રીએ જ્યુબિલી ગાર્ડન ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૨૨૫૭૦૭, અને ૦૨૮૧-૨૨૨૮૭૪૧) અને ફાયર & ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૦૨૮૧-૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ કાર્યરત્ત કરાવેલા છે જેથી કરીને અને ત્યાં નોંધાતી ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા તાકિદ કરી છે.

દરમ્યાન મ્યુનિ. કમિશનર શ્રી બંધાનિધિ પાનીએ વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઈપણ વિકટ પરિસ્થિતિમાં પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી

આવશ્યક સેવાઓ ડીસ્ટર્બ ના થાય અને ભારે પવનને કારણે જો કોઈપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલિક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવાની દીધા છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદની સંભાવના પણ હોવાથી નીચાણવાળા વિસ્તારો તથા અન્ડર બ્રિજમાં પાણી ભરાય તો તેને તાત્કાલિક ડીવોટરિંગ કરવા માટે પંપ અને સ્ટાફ તૈયાર રખાયા છે. શહેરમાં પીવાનાં પાણીનું વિતરણ કોઈ પ્રકારે ડીસ્ટર્બ નાં થાય તે જોવા સિટી ઈજનેરોને સૂચના આપવામાં આવી છે, અને મહાનગરપાલિકાના તમામ વોટર પમ્પિંગ સ્ટેશનોએ ઈલેક્ટ્રીક સ્પલાય ડીસ્ટર્બ થાય તો તેવા કિસ્સામાં જનરેટરની મદદથી પમ્પિંગ ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. શહેરમાં રાહત બચાવની અસરકારક કામગીરી માટે ફાયર બ્રિગેડ સહિત મહાનગરપાલિકાના તમામ વાહનો ડીઝલનાં પુરતા જથ્થા સાથે જ તૈયાર રાખવામાં આવેલ છે. મહાનગરપાલિકાનાં તમામ અધિકારીઓ "આઈ-વે પ્રોજેક્ટ"ના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)નો પુરેપુરો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.

-:ઉપયોગી ફોન નંબરો:-

➤ ફાયર કંટ્રોલ રૂમ

ફોન. ૦૨૮૧-૨૨૨૫૭૦૭,

૦૨૮૧-૨૨૨૮૭૪૧

- ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, સેન્ટ્રલ ઝોન કચેરી, કનક રોડ,
૦૨૮૧-૨૨૨૭૨૨૨, ૨૨૩૬૧૮૩, ૨૨૩૭૧૮૪, અને ૧૦૧ તથા ૧૦૨
- કોઠારિયા રોડ ફાયર બ્રિગેડ
૦૨૮૧-૨૩૬૫૪૪૪
- કાલાવડ રોડ ફાયર બ્રિગેડ
૦૨૮૧-૨૫૮૫૭૭૧
- રામાપીર ચોક ફાયર બ્રિગેડ
૦૨૮૧-૨૫૭૪૭૭૩
- મવડી રોડ ફાયર બ્રિગેડ
૦૨૮૧-૨૩૭૪૭૭૪
- બેડીપરા રોડ ફાયર બ્રિગેડ
૦૨૮૧-૨૩૮૭૦૦૧

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા